

GMM/SEC/2022-23/80

February 3, 2023

To, **BSE Ltd** Phiroze Jeejeebhoy Towers, 1<sup>st</sup> Floor, Dalal Street, Mumbai – 400 001

NSE Ltd Exchange Plaza, C-1, Block G, Bandra Kurla Complex, Bandra (E) Mumbai – 400 051

Scrip Code: 505255

Symbol: GMMPFAUDLR

Sub.: Copy of Published Unaudited Standalone & Consolidated Financial Results for the quarter ended December 31, 2022

Ref.: Regulation 30 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations")

Dear Sir/ Ma'am,

In terms of Regulation 30 read with Regulation 47 of the SEBI Listing Regulations, please find enclosed a copy of the Unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended December 31, 2022 published in Economic Times, Mumbai & Ahmedabad Edition and in Naya Padkar, Anand on February 3, 2023 for your records.

Kindly acknowledge receipt of the same.

Thanking you.

Yours faithfully,

For GMM Pfaudler Ltd

Mittal Mehta **Company Secretary & Compliance Officer** FCS. No. 7848

Encl.: As above

GMM Pfaudler Ltd.

Corporate Office: 902 VIOS Tower, New Cuffe Parade, Sewri-Chembur Rd, Mumbai 400037 Registered Office & Works: Vithal Udyognagar, Anand - Sojitra Road, Karamsad - 388325 O: +91 22 6650 3900 | F: +91 2692 661888 | CIN: L29199GJ1962PLC001171 W: www.gmmpfaudler.com | E: sales@gmmpfaudler.com













cn

=


tin ti

w

w

ŝ

1 5 3 7 9 9 1 8 6 10 11 15 13 17 12 19 11 18 16 50 51 55 53 57 59 57 58 56 30 31 35 mp 0 13 8 THE ECONOMIC TIMES | MUMBAI | FRIDAY | 3 FEBRUARY 2023 | WWW.ECONOMICTIMES.COM





## Driving the best drain intervals, delivering unparalleled value

Guiff Oil Lubricants Registers & Corporate Office: N Centre, 4950, MIDC, 122h Roud, Andher (E), Muntha-40003, Maharashta, India, DN No. 1220/2049/C0207.027 No. 4, 1972, 26457777 1073 107, 177, 174 107,

			Consolidated		
Particulara	Quarter ended December 31, 2022 (Unaudited)	Nice Months ended December 31, 2022 (Unaudited)	Quarter ended December 31, 2021 (Unaudited)	Quarter ended December 31, 2022 (Unaudited)	Nine Months ender December 31, 202 (Unaudited)
Revenue from Operations	78,109.80	2,20,705.03	60,182.18	78,109.80	2,20,705.0
Profit from ordinary activities before tax	8,431.07	22,868.41	7,861.92	8,431.80	22,870.3
Net Profit from ordinary activities after tax	6,265.27	17,012.70	5,862.92	6,266.00	17,014.6
Total Comprehensive Income for the period (comprising Profit and other Comprehensive Income for the period)	8,939.99	19,688.21	5,871.08	8,940.72	19,690.1
Equity share capital (Face value ₹ 2 per share)	980.34	960.34	1,008.55	960.34	990.34
Earnings Per Share (Face value ₹ 2 per share) a) Basic-₹ b) Dilutod-₹	*12.78 *12.73	*34.62 *34.50	*11.63 *11.63	*12.78 *12.73	*34.6 *34.5

For and on behall of Board of Directors of GULF OIL LUBRICANTS INDIA LIMITED

E

Place : Mumbai Date : February 02, 2023

## GMM PFAUDLER LIMITED

Registered Office & Works : Vithal Udyognagar, Karamsad 388 325, Gujarat, India CIN No: L29199GJ1962PLC001171, Email ID : investorservices@gmmpfaudler.com Website : www.gmmpfaudler.com EXTRACT OF STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULTS


## FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2022

Particulars noome from Operations ofit / (Loss) (before tax, Exceptional items) ofit / (Loss) before tax Exceptional items) ofit / (Loss) after tax Exceptional items) comprehensive Income for the period o Equity Share Capital	Quarter ended 31.12.2022 Unaudited 792.31 56.42 34.85 18.67	Quarter ended 30.09.2022 Unaudited 780.05 101.40	ended	ended	Nine Months ended 31.12.2021 Unaudited 1,841.20 89.66	ended	
ncome from Operations ofit / (Loss) (before tax, Exceptional items) ofit / (Loss) before tax Exceptional items) ofit / (Loss) after tax Exceptional items) comprehensive Income for the period	31.12.2022 Unaudited 792.31 56.42 34.85	30.09.2022 Unaudited 780.05 101.40	31.12.2021 Unaudited 642.28	31.12.2022 Unaudited 2,311.60	31.12.2021 Unaudited 1,841.20	31.03.202 Audited 2,540.5	
ofit / (Loss) (before tax, Exceptional items) ofit / (Loss) before tax Exceptional items) ofit / (Loss) after tax Exceptional items) comprehensive Income for the period	792.31 56.42 34.85	780.05 101.40	Unaudited 642.28	Unaudited 2,311.60	Unaudited 1,841.20	Audited 2,540.5	
ofit / (Loss) (before tax, Exceptional items) ofit / (Loss) before tax Exceptional items) ofit / (Loss) after tax Exceptional items) comprehensive Income for the period	56.42 34.85	101.40					
ofit / (Loss) before tax Exceptional items) ofit / (Loss) after tax Exceptional items) comprehensive Income for the period	34.85	2000540	49.67	241.25	89.66	133.3	
Exceptional items) ofit / (Loss) after tax Exceptional items) comprehensive Income for the period		101.40					
Exceptional items) comprehensive Income for the period	18.67		49.67	219.68	89.66	133.3	
- F		96.89	37.69	177.03	58.09	75.36	
n Equity Share Canital	74.76	111.53	33.90	255.19	69.91	148.54	
Value of ₹ 2/- each)	8.99	8.99	2.92	8.99	2.92	2.92	
Equity						524.19	
gs Per Equity Share on net profit after tax baid-up equity share of ₹ 2/- each) inualised)							
ic	4.15	14.81	7.26	28.97	15.74	19.39	
ted	4.15	14.80	7.26	28.96	15.74	19.39	
bers of Unaudited Standalone Finan	cial Resu	ults					
	Standalone						
Dertertory	Quarter	Quarter	Quarter	Nine Months		Year ended	
Particulars	31.12.2022		31.12.2021				
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
er	276.59	256.13	208.97	781.73	586.28	814.8	
efore tax	28.43	28.92	26.77	85.35	99.31	127.03	
fter tax	22.45	21.35	19.53	64.66	74.61	94.96	
	si Per Equity Share on net profit after tax aid-up equity share of ₹ 2/- each) nualised) 2 ed bers of Unaudited Standalone Finan Particulars afore tax ter tax ter tax bove is an extract of the detailed format ne Stock Exchanges under Regulatiorements) Regulations, 2015. The full for	IS Per Equity Share on net profit after tax aid-up equity share of ₹ 2/- each) nualised) ad 4.15 bers of Unaudited Standalone Financial Resu Particulars Particulars Particulars afore tax ter tax 22.45 Partex of the detailed format of quarter he Stock Exchanges under Regulation 33 of the stock Exchanges under Regulations, 2015. The full format of quarter he Stock Exchanges under Regulation 33 of the stock Exchanges under Regulations, 2015. The full format of quarter he Stock Exchanges under Regulation 33 of the stock Exchanges under Regulation 33 of the stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 33 of the stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter he Stock Exchanges under Regulation 35 of the full format of quarter bases and the stock Exchanges under Regulation 35 of the full format of quarter bases and the stock Exchanges and the stock Exchanges and the stock Exchanges and the stock Exc	Is Per Equity Share on net profit after tax aid-up equity share of ₹ 2/- each) nualised) add 4.15 14.81 add 4.15 14.80 bers of Unaudited Standalone Financial Results Particulars Particulars afore tax 28.43 28.92 ter tax 22.45 21.35 bers of Quarter and nine ne Stock Exchanges under Regulation 33 of the SEBI rememshs Regulations, 2015. The full format of quarter and nine	si Per Equity Share on net profit after tax aid-up equity share of ₹ 2/- each) nualised)     4.15     14.81     7.26       c     4.15     14.80     7.26       bers of Unaudited Standalone Financial Results     Stanc       Particulars     0uarter ended     0uarter ended     0uarter ended       11.12.0223 (0x022) 311.2021     11.2023 (0x022) 311.2021       or     276.59     256.13     208.97       afore tax     28.43     28.92     26.77       ter tax     22.45     21.35     19.53       bowe is an extract of the detailed format of quarter and nine months the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing of Listing of Listing of Listi	Sper Equity Share on net profit after tax aid-up equity share of ₹ 2/- each) nualised)         4.15         14.81         7.26         28.97           ad         4.15         14.81         7.26         28.97           ad         4.15         14.80         7.26         28.97           ad         4.15         14.80         7.26         28.97           bers of Unaudited Standalone Financial Results         Image: Comparison of the ended o	Sper Equity Share on net profit after tax aid-up equity share of ₹ 2/- each) nualised)         4.15         14.81         7.26         28.97         15.74           2         4.15         14.81         7.26         28.97         15.74           ad         4.15         14.80         7.26         28.97         15.74           bers of Unaudited Standalone Financial Results         Example         Standalone         Income of the ended         <	

Pfaudler

Sd/-Tarak Patel

Place : Mumbai Date : February 02, 2023





From budget allocation to tax reforms, we've got you covered! Get all the key highlights and insights on the Union Budget 2023. Stay informed and stay ahead.

1

9

10

4

0

N

0

Get the latest budget news and analysis only on ETNowNews.com

Place : Mumbai Date : February 02, 2023

3

4 36

6

7 Other Equity

1. Basic

2. Diluted

1 Turnover

2 Profit before tax

3 Profit after tax

(not annualised)

35

37

ŵ

39 8

40

4

42

43

44

45

46

47 Notes:

48 49 8

01-

(i) The a

Net Profit / (Loss) before tax

101.40

96.8

111.53

8.99 2.92

34.85

18.6

74.76

8.99

4.15 14.81

4.15 14.80

Quarter

276.59

28.43

22.45

The above is an extract of the detailed format of quarter and nine months ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarter and nine months ended financial results are available on the Stock Exchange websites viz. www.seeindia.com and www.nseindia.com. The same is also available on the company's website viz. www.gmmpfaudler.com.

Quarter ended

256.13 208.97

28.92

21.35

49.67

37.69

33.90

7.26 28.97 15.74

7.26 28.96 15.74

Quarter ended Nine Months ended

26.77

19.53

Standalone

31.12.2022 30.09.2022 31.12.2021 31.12.2022 31.12.2021 31.03.2022

781.73

85.35

64.66 74.61

219.68

177.03

255.19

8.99 2.92

89.66

58.09

69.91

ne Months Year

Unaudited Audited

586.28

99.31

For GMM Pfaudler Limited

133.38

75.36

148.54

2.92

524.19

19.39

19.39

814.82

127.02

94.96

Sd/-

Tarak Patel

Managing Director DIN: 00166183

(after Exceptional items)

(after Exceptional items)

Net Profit / (Loss) after tax

Paid-up Equity Share Capital

(Face Value of ₹ 2/- each)

5 Total Comprehensive Income for the period

Earnings Per Equity Share on net profit after tax

Particulars

Key numbers of Unaudited Standalone Financial Results

(Fully paid-up equity share of ₹ 2/- each)

આપંદ, તા.

સરદાર પટેલ

અરડી

થકી માતત્વ અને બાળ સંભાળ

માટે જરૂરી બેલેન્સ ડાયટ,

નિયમિત રસીકરણ અને

નિયમિત કસરત કરવા અંગેની

સમજણ આપવામાં આવી

હતી.જેમાં સમાજ કાર્ય

વિભાગના વિદ્યાર્થીઓએ

વિભાગના હેડ પ્રોફેસર ડો.

શિવાની મિશ્રાના માર્ગદર્શન

હેઠળ યોજવામાં આવ્યો હતો.

0

પેટલાદ તાલુકાના

યુનિવર્સિટીના સમાજ કાર્ય

વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા

સગર્ભા બહેનો માટે સુરક્ષિત

માતા સુરક્ષિત બાળક થીમ

ઉપર ગામમાં આવેલ પ્રાથમિક

આગોગ્ય કેન્દ્ર ખાતે જન

જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં

આવ્યો હતો. જેમાં સગભાં

ગામ ખાતે

## ભવેલ ગામે વરસાદી ગટરનું કામ અરડી ખાતે સુરક્ષિત માતા સુરક્ષિત બાળક અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો નિયત નકશા અને એસસ્ટીમેન્ટ મુજબ ના થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો

આણંદ, તા. ૨

ખંભાત તાલકાના ભવેલ

ગામ પંચાયત દારા ૧૫માં

નાંણા પંચની ગ્રાન્ટમાં

વરસાદી પાણીના નિકાલ માટે

ગટરનું કામ કરાયું છે.જે કામ નિયત નકશા મુજબ થયેલ

ઉઠી છે.

ખેડા જિલ્લા સહકારી

કરવો. ફોન નં. ૯૭૨૭૭૦ ૩૨૦૫ (ટેન્ડરમાં સંપૂર્ણ માઠીતી દર્શવિલ છે.)

કોઇપણ કારણ દર્શાવ્યા વગર કોઇપણ ટેન્કર પંપુર કરવું, અંશતઃ મંપુર કરવું, ચા નામંપુર કરવું તેની સંપુર્ણ સત્તા સંઘના મેનેજિંગ ડિરેક્ટરસીને રહેશે.

Particulars

Total Income from Operations

भीननी ७/१२ नी

મેનેજિંગ ડિરેક્ટર

**GMM PFAUDLER LIMITED** 

Registered Office & Works : Vithal Udyognagar, Karamsad 388 325, Gujarat, India

CIN No: L29199GJ1962PLC001171, Email ID : investorservices@gmmpfaudler.com Website : www.gmmpfaudler.com

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2022

792.31

56.42 101.40

780.05

છે.એક સ્થાનિક રહીશના દ્વારા કરાયું છે.જે કામમાં જણાવ્યા મુજબ પંચાયત અને કેટલાક મળતીયાઓ કોન્ટાકટર સાથે મળી એસટીમેન્ટ તથા કોન્ટાકટરને ખર્ચ ઓછો થાય તે રીતે ઉપર છહ્યુ ખોદકામ નકશા મુજબ કામ ન કરતા જેના કારણે વધુ વરસાદનું છી લાઇન નાંખવાનો કર્યો છે. પાણી કોર્સમાં આવે તો ગામમ

આક્ષેપમાં પંચાયતના સભ્યો અને મળતીયાઓ કોન્ટ્રાકટર સાથે મળી ગેરરીતિ આચર્યા હોવાનો આક્ષેપ કર્યો

> ઘુસી જવાની સંભાવના છે.જેથી ગામજનોએ પંચાયતના તલાટી ક્રમ મંત્રી અને તાલુકા કક્ષાએ લેખિત જાણ કરી આ કામને નિયત પક્ષાનીગ મુજબ કરવા અને અંતે કામની યોગ્યતાની ચકાસણી કરી કોન્ટ્રાકટરને બિલ

આ અંગે ગ્રામ પંચાયતના સભ્ય

સભ્યોએ જિજ્ઞાવિકાસ અધિકારી આણંદને લેખિતમાં રજુઆત કરીને ગામના હિતમાં નાંમાપંચની ૧૫માં

ના હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સભ્યોએ કર્યો છે,અને કોન્ટ્રાકટર સામે સોનલબેન પરમાર સહિત અન્ય

યોગ્યતાના ધોરણે કામ કરવામાં આવે તેવી માંગ કરી છે. ગ્રાન્ટમાંથી વરસાદી પાણીના નિકાલની ગટર ભુવેલ પંચાયત

મુજબ ના થતો હોવાનો ગંભીર

આક્ષેપ સ્થાનિકોના કરી રહ્યા

0

Amul

પણ પ્રશનો ઉભા કર્યા છે.જે અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે એવી માંગ વરસાદી પાણી નિકાલ માટે ગટરનું કામ આડેઘડ રીતે લાઇન નાંખી ગેરરીતિ આચરી તંત્રએ નક્કી કરેલા માપદંડ

ચુકવા રજૂઆત કરી છે. AMUL DAIRY, ANAND, GUJARAT, INDIA. KAIRA DISTRICT CO-OPERATIVE MILK PRODUCERS' UNION LTD ANAND 388 001, Gujarat. Phone : (02692) 256124, 256224 Tender Notice

Amul Dairy - Kaira District Co-operative Milk Producers' Unio Ltd., Anand, Gujarat, India, invites rates through E-Tender fror Period EMD in Rs. S.N. Description of ARC

Annual Rate Contract 2023-2024 50.000/ 1. for Miscellaneous **Fabrication Work** 

The details of E-tender can be downloaded free of cost from the The details of E-tender can be downloaded three of cost from the Weblic <u>http://tender.amuldaive.com</u> after online registration. The on-line tender will be available for access from DL 03.02.2023 to DC.90.02.2023. The completed field in physical form all be received up to 17.00 hours on 09.02.2023 by Sr. Manage (Purchase), Admin Building, Amul Dairy, Anand 388 001. Crivent Judis ijarat, India.

etails regarding eligibility criteria, specifications and other ns are av ilable in the tender format from the above rebsite. The Amul Dairy reserve the ri my or all the tenders without assigning serve the right to accept or reject ason the **Managing Directo** Date : 03.02.2023

Quarter Nine Mo ended ende 1.12.2021 31.12.2

642.28

49.67 241.25 ended 31.12.200

89.66

89.66

58.09

69.91

2 540 5

133.38

133.38

75.3

148.54

2.92

524.19

19.39

19.3

ed Unaudited Unaudited Unaudited Audited

219.68

177.03

255.19

8.99 2.92

28.97 15.74

28.96 15.74

2,311.60 1,841.20

દૂધ ઉત્પાદક સંઘ લિ. અમૂલ અમૂલ કેરી, આણંદ. જમીન વેચાણ અંગેની ટેન્ડર નોટીસ આ સાથે જણાવવાનું કે મોજે આણંદ ટી.પી. સ્ક્રીમ નંબર ૪, ફા.પ્લો નંબર ૨૦૩, જેનું લગભગ સંત્રકૃળ ૧૯૩૫.૦૦ ચોરસ મીટર (સૂર્યનગરી સોસાયટી, ગણેશ ચોકડી પાસે, આણંદ) વાળી પ્રાઈમ લોકેશન પર પર લઇ તાત્કાલિક ઘોરણે રમણભાઇ સોલંકીના હસ્તે આવેલ "ખેડા જિલ્લા સફકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., આરાંદ (અમૂલ જાહેર જનતાને ગેસ મળી ડેરી)" ની સંપુર્ણ માલિકી, કબજા ભોગવટા ની ખુલ્લી જમીન વેચાર કરવાની હોય, ખરીદવા દધ્યક્તી પાર્ટીઓએ આ જમીનની ૭/૧૨ ન રહે તે હેતુથી ગેસ પાઇપ કરવાની હીય, પ્લીટલા પિયત્રી પારાઆગ આ ગળનાના ગ્/૧૬ ના ચિત્રત અનારી વેબસાઇર : <u>http://tender.amuldairy.com/</u> પરથી તા.૩/૦૨/૨૦૨૩ થી ૧૦/૦૨/૨૦૨૩ સુધી કોળેલાકે કરે લેવાના રહેશે. ભરેલ ટેન્ડર તા.૧૦/૦૨/૨૦૨૩ (બપોરના ૩:૦૦) સુધી રૂ. ૨,૫૦,૦૦૦/– અનેરટ મની કિપોરટિની રકમના દિમાન્ક ડૂચર અને સ્ટ્રાં છે. વિત્યાં એ વિત્યાં કરવા પ્રેશની સ્ટાયટા કરે છે. લાઇન વહેલી તકે નાખવામાં આ પ્રસંગે પ્રાન્ત અધિકારી ના પરચેઝ વિભાગમાં સીલબંધ કવરમાં મોકલી આપવાના રહેશે. રસ ઘરાવતી પાર્ટીઓએ વધુ માફીતી માટે અમારા અધિકારીઓનો સંપર્ક

dl. 03.02.2023

જયકુમાર બારોટ- ડેપ્યુટી કલેકટર એન્ડ એસ.ડી.એમ. ચિફ ઓફિસર વાય.જે. ગણતરા, દિપકભાઇ પટેલ- શહેર ભાજપ પ્રમુખ, બોરસદ હાજર રહયા હતા. ટંક સમયમાં જ ચરોતર ગેસ દ્વારા બોરસદ શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં પાઇપ લાઇન થકી ગેસ પુરો પાડવામાં



સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તીર્થધામ વડતાલ ગ્રામ પંચાયત પાછળ શ્રી શશીકાંત રામભાઇ પટેલ (રામભાઇ મુખી પરિવાર)ના ૨૫ લાખના અનુદાન સહયોગથી અ.નિ. મંગળાબેન પટેલ જનઆરોગ્ય કેન્દ્ર તથા અ.નિ. મંગળાબેન પટેલ કિશોરી કલ્યાણ કેન્દ્રનું ખાતમુહૂર્ત પૂર્વ મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ (ધારાસભ્ય નડીઆદ) વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલભ સ્વામી, દાતા મુખી પરિવારના શશીકાંત પટેલ દ્વારા સંપન્ન થયું. આ સમયે જિદ્યા પંચાયત સભ્ય દિનેશભાઇ, સરપંચ અમિતભાઇ, ડે.સરપંચ મિતલભાઇ, તાલકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઇ, અગ્રણી રાકેશભાઇ, પંચાયતના સભ્યો તેમજ અગ્રણીઓ ઉપસ્થિ રહયા હતા. (તસવીર : રાજુ મહંત, નડીઆદ)

# ચરોતર ગેસ દ્વારા બોરસદ શહેરમાં PNG ગેસનું ખાતમુહ્ર્ત કરવામાં આવ્યું STAN A BORT 1.Cr આવશે



વિસ્તરણ કરવા માટે મુખ્ય દંડક રમણભાઇ

લાઇન થવી ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો ચાલુ

સોલંકીની ઉપસ્થિતિમાં

હતા. જે ચરોતર ગેસના

ચેરમેન ધર્મેન્દ્રભાઇ જે. પટેલ

### ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ દ્વારા આ કામને ત્વરિત હાથ છેલા ઘણા સમયથી ગેસ આવનાર છે

## આણદ : બંકોમા લોન લેવા માટેની ૧૮૯૦ અરજીઓ મળી માટે પોલીસ તંત્ર દ્વારા પહેલી | હતી. આ સમય દરમિયાન બેંકો આણંદ તા.ર આણંદ જિલ્લા પોલીસ

નાયબ

દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ હાથ ઘરવામાં આવી રહી છે. મંગળવારના રોજ ત્રણ વ્યાજ ખોરોના ત્રાસથી એક મુસ્લિમ યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. વ્યાજખોરોની ચુઝાલમાંથી નિર્દોય નાગરિકોને છોડાવવા બાબતે પોતાની રજૂઆતો કરી વેન્ડરની આત્મ નિભર નિધિ

તાબડતોબ ઘટના સ્થળે

પહોંચી હતી. તારાપુર પોલીસ

દારા મૃતદેહનો કબ્જો લઈ ૧૦૮

મારકતે મૃતક બાઈક ચાલક ને

પી એમ અર્થે તારાપુર સરકારી

ઘની, પાંચમાં

10.00 9412

ચની, પશ્ચમ

બોરસદ શહેરમાં ચરોતર

ગેસ સહકારી મંડળી લીમીટેડ,

વિક્રવ ઉદ્યોગનગર દ્વારા

ર૫૫૦૬ ગેસ નેટવર્ડનું

કેબ્રુઆરીના રોજ હેડ ક્વાર્ટસ ખાતે લોન કેમ્પનં આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અલગ અલગ બેંકો દ્વારા બનાવવામાં આવેલ સ્ટોરો ઉપર આણંદ જિહ્વામાંથી કુલ ૫૮૩ નાગરિકોએ મુલાકાત લીધી હતી. જેઓએ લોન

આપવામાં આવતી લોનોની સરળતાપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આણંદ વિષ્ટ્રામાંથી આવેલા નાગરિકોએ હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન, શિક્ષણ લોન, પીએમ સ્ટ્રીટ

દ્રારા અલગ અલગ હેતુ માટે

તારાપુર : કાર અને બાઇકનો અકસ્માત, બાઇકચાલકનું મોત તારાપુર,તા.૦૨ વરામણ તરકથી તારાપર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં તરક આવી રહેલ કાર અને આવ્યો હતો.અકસ્માતમાં કાર રોંગ સાઈડે હાઈ વે પર તારાપર તરક થી આવતી બાઈક પામ્યું હતું. વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતાં ૧૦૮

પોલીસ મથકે લાવવા માં આવ્યું અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ઘરી હોવાનું બાણવા મળે છે

રપેક એસ.પી.સી.એ.એમ. (બી.સી.એ.–૩ સેમ)નું ગૌરવ

e.uo જીપીએ

૯.૫૦ જીપીએ

હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતક પાસેના ઓળખના પુરાવાના આધારે

૯.૫૦ જીપીએ g. 1 શની, પાંચમાં ม่างม

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) બાકરોલ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશનો એન્ડ મેનેજમેન્ટ (બી.સી.એ.)ના તૃતીસય સેમેસ્ટરના વિદ્યાર્થીઓ મયંક પંજાબીએ ૧૦.૦૦ જીપીએ સાથે યુનિ. પ્રથમ, ચિરાગ બારૈયા કલ્પેશ ચૌહાણ અને પારસ બારિયાએ ૯.૫૦ જીપીએ સાથે યુનિ. પાંચમાં તેમજ કેતુલ પંચાલએ ૯.૩૬ જીપીએ અને યુનિ. સાતમાં સ્થાન મેળવી ક્રમશઃ કોલેજ પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે.

## બેંક દ્વારા લોન આપવામાં આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. તેમ જિદ્ધા પોલીસ દારા જણાવવામાં આવે 2Ì ભાદરણ જવાહર

વગેરે મળીને અલગ-અલગ

લોનઘીરાણો માટે તમામ

બેન્કોમાં કલ ૧૮૯૦ અરજીઓ

જે અરજીઓને આધારે

મળેલ છે.

# પ્રવેશ માટે

મંત્રાલય દ્વારા સંચાલિત વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઘોરણ હાલમાં ચાલુ છે.

નોઇડા ના તાજેતરના પરિપત્ર મુજબ ઓનલાઇન અરજીપત્રક ભરવાની મુદ્દત જે અગાઉ તા. 39/09/2023 edl day કેરકાર કરીને ઓનલાઇન અરજીપત્રક ભરવાની મુદ્દત તા. 02/02/2023 સઘી લંબાવાઇ છે. જેને ધ્યાને લઇ અરજીપત્રક ભરવા ઇચ્છુક દરેક વિદ્યાર્થીઓ/ વાલીઓને નવોદય વિદ્યાલય સમિતીની વેબસાઇટ www.navodaya.gov.in પરથી અરજીપત્રક ભરવા ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની એક યાદીમાં જણાવાયું છે.

સમયમર્યાદા વધારાઇ

ભારત સરકારના શિક્ષણ ભાદરણ જવાસ્ટ નવોદય દમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન અરજીયત્રક ભરવાની પ્રક્રિયા

નવોદય વિદ્યાલય સમિતિ,

2 Net Profit / (Loss) (before tax, Exceptional items) 3 Net Profit / (Loss) before tax (after Exceptional items) 49.67 34.85 101.40 Net Profit / (Loss) after tax 18.67 37.69 (after Exceptional items) 96.8 5 Total Comprehensive Income for the period 74.76 111.53 33.90 6 Paid-up Equity Share Capital (Face Value of ₹ 2/- each) 8.99 8.9 2.92 Other Equity 8 Earnings Per Equity Share on net profit after tax (Fully paid-up equity share of ₹ 2/- each) (not annualised) 1. Basic 4.15 14.81 7.26 2. Diluted 4.15 14.80 7.26 Key numbers of Unaudited Standalone Financial Results

Standalone Quarter ended Quarter N ended ne Mon ended ended Particulars 31.12.2022 30.09.202 31.12.202 31.12.2022 31.12.202 31.03.202 1 Turnover 276.59 256.13 208.97 781.73 586.28 814.82 2 Profit before tax 99.31 127.02 28.43 28.92 26.77 85.35 3 Profit after tax 22.45 21.35 19.53 64.66 74.61 94.96

(i) The above is an extract of the detailed format of guarter and nine months ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarter and nine months ended financial results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com. The same is also available on the company's website viz. www.gmmpfaudler.com

> -GMM-Pfaudler

For GMM Pfaudler Limited

Tarak Patel Managing Director DIN: 00166183

Place : Mumbai Date : February 02, 2023

અને બાઇકને ભારે નુકશાન થવા અકસ્માતમાં નકશાનગ્રસ્ત મોટરસાઇકલ ને તારાપુર હોવાનું તથા તારાપુર પોલીસ

e.35 જીપીએ

4.

આણંદ, તા. ર

નવોદય વિદ્યાલયમાં